

ત્વરિત જાહેરાત માટે

## ઓગસ્ટ 21 થી 23 સુધી કલ્ચર કોલ્સ વિકેન્ડર (Culture Calls Weekender)માં બ્રેમ્પટનની સર્જનાત્મક પ્રતિભાની શોધ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (14 ઓગસ્ટ 2020) – સિટી ઓફ બ્રેમ્પટન રજૂ કરે છે કલ્ચર કોલ્સ વિકેન્ડર (Culture Calls Weekender), જે ઓગસ્ટ 21 થી 23 સુધી થનાર ઓનલાઇન ઇવેન્ટ છે જેમાં બ્રેમ્પટનની ઉભરતી સર્જનાત્મક પ્રતિભાઓ દ્વારા અભિનય, પેનલ વાર્તાવાપો અને કાર્યશાળાઓ રજૂ થશે.

કલ્ચર કોલ્સ વિકેન્ડર (Culture Calls Weekender) સર્જનાત્મક અભિવ્યક્તિ, સહયોગ અને સમાજ માટે એક ડિજિટલ અનુભવ બની રહેશે. હાસ્ય કલાકારો, સંગીતકારો અને વક્તાઓ સહિત 15 કલાકારો Instagram Live @TheRoseBrampton, અને Zoom પર દરોઝ વર્ચુઅલ સ્ટેજ પર થનાર ત્રણ દિવસીય ઉત્સવમાં સહભાગી થશે.

ઉત્સવમાં ભાગ લેનાર કલાકારોમાં સમાવેશ થશે બ્રેન્ડન એશ-મોહમ્મદ (Brandon Ash-Mohammed), માર્ટિન અનોન (Martín Añón), માયા કિલ્ટ્રોન (Maya Killtron), [TRP.P](#), [નિકોલ ચેમ્બર્સ \(Nicole Chambers\)](#), [રીકો રીફ \(Reeko Rieffe\)](#), રેચલ બ્રાઉન (Rachelle Brown), આર. ફ્લેક્સ (R. Flex) અને રોશની (Roshanie), જોએલ વ્હાઈટ (Joelle White), જોઝફિન ક્રુઝ (Josephine Cruz), કેઓશા લવ (Keosha Love), લિટની સ્પિઅર્ઝ (Litney Spearz), [જોયિઆ \(Joyia\)](#), [દેસિરી મકેન્ઝી \(Desiree Mckenzie\)](#), અને [સિદ્ધાર્થ \(Siddhartha\)](#)

કલ્ચર કોલ્સ વિકેન્ડર (Culture Calls Weekender) કલ્ચર કોલ્સ (Culture Calls)નું સિટી ઓફ બ્રેમ્પટન દ્વારા થયેલ વિસ્તરણ છે જે સ્થાનિક DJ અને રેડિયો હોસ્ટ રોશની દ્વારા હોસ્ટ થશે જેથી COVID-19 દરમિયાન આપણા સમાજના કલાકારોને મદદરૂપ થઈ શકાય. આ ઉત્સવ માટેનું નેપથ્ય બ્રેમ્પટનની જ કલાકાર જાસ્મિન પન્નુ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દેખાશે બ્રેમ્પટનનાં અસલ સીમાચિહ્નો અને દ્રશ્યો જેમકે ગાર્ડન સ્ક્વેર, 410 ચિલ્ડ્રન અને સોનિઝ (Sonny's).

[ઇવેન્ટ્સના સંપૂર્ણ સમયપત્રક માટે અહીં ક્લિક કરો.](#)

### અવતરણો

“કલ્ચર કોલ્સ (Culture Calls) બ્રેમ્પટનના સર્જનાત્મક સમુદાયમાં COVID-19 રોચાળા દરમિયાન અત્યંત સફળ રહ્યું છે અને જ્યારે વધુ સ્થાનિક કલાકારો સાથે મળીને કલ્ચર કોલ્સ વિકેન્ડર (Culture Calls Weekender) માં બ્રેમ્પટનને પ્રેરિત કરશે તે માટે મને રોમાંચની લાગણી થાય છે. "તમારે સુંદર સંગીત સાંભળવું હોય કે હાસ્ય મનોરંજન મેળવવું હોય, હું બધાંને આ સપ્તાહના અંતે Instagram Live અને Zoom મારફત આ ઓનલાઇન ઇવેન્ટમાં હાજર રહેવા પ્રોત્સાહિત કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટનના સર્જનાત્મક સમુદાય માટે કલ્ચર કોલ્સ વિકેન્ડર (Culture Calls Weekender) એક રોમાંચક અને મહત્વનો ઇવેન્ટ છે ખાસ કરીને આવા મુશ્કેલીભર્યા સમયમાં. બ્રેમ્પટનમાંની કલા અને સંસ્કૃતિનું દ્રશ્ય વિકસિત થઈ રહ્યું છે, અને એક બીજાને ટેકો આપવા અને સશક્તિકરણ કરવા માટે આપણા સમુદાયને સાથે લાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. તમારા કેલેન્ડરમાં ચોક્કસપણે તારીખો અને ઇવેન્ટ્સને લખી રાખજો."

- પૉલ વિસેન્ટ, પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર), વૉર્ડ 1 અને 5; ઇકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચરનાં ઉપ પ્રમુખ

"દરોજ વર્ચુઅલ સ્ટેજ પર કલ્ચર કોલ્સ વિકેન્ડર (Culture Calls Weekender) હાથ ધરવા માટે અમે ઉત્સુક છીએ. પર્ફોર્મિંગ આર્ટ્સ (Performing Arts) ખાતે અમને કલ્ચરમાં આપણા સિટીના ટીમમેટ્સ અને સ્થાનિક ક્યુરેટરો સાથે કાર્ય કરવામાં હંમેશા સન્માન અને આનંદની લાગણી થાય છે અને એક અગત્યનો પ્રસંગ બનાવવા માટે આ એક સચોટ રીત છે જેથી તેના તમામ નાગરિકો માટે બ્રેમ્પટનને પ્રવૃત્ત કરી શકાય."

- સ્ટિવન સ્ચિપર (Steven Schipper), એગ્જિક્યુટિવ આર્ટિસ્ટિક ડાયરેક્ટર, પર્ફોર્મિંગ આર્ટ્સ, સિટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટન પ્રતિભાથી છલકાય છે અને તે પ્રતિભાને ભેગી થઈ શકી તે અમારા કલ્ચર સર્વિસિસના કર્મચારીઓના ખંતપૂર્વક કાર્ય કરવાનું પરિણામ છે. આવા મુશ્કેલીભર્યા સમયમાં કલ્ચર કોલ્સ વિકેન્ડર (Culture Calls Weekender) આપણી કલા અને સંસ્કૃતિના સમુદાય માટે દિવાદાંડી બની રહેશે."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)